

નાદારી કાયદા હેઠળ કરજવિવાદના નિકાલની સંખ્યા ઘટી રહી છે

મુંબઈ, તા. ૩ જૂન
ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (આઈબીસી) ૨૦૧૬ હેઠળ નાણાકીય લેણદારો, ઓપરેશનલ લેણદારો અને કોર્પોરેટ દેવાદારો જેવા હિસ્સેદારો દ્વારા શરૂ કરાયેલ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (સીઆઈઆરપી) હજી પણ ધીમી ગતિએ ચાલી રહી છે.

ઉપરોક્ત હિસ્સેદારો દ્વારા શરૂ કરાયેલ સીઆઈઆરપીની સંખ્યા નાણાં વર્ષ ૨૦૨૩માં ૧૨૬૨ હતી અને તે નાણાં વર્ષ ૨૦૨૪માં ઘટીને ૭૨૩ થઈ છે, જ્યારે ઉપરોક્ત સમયગાળા દરમિયાન પુનર્ગઠન યોજનાની મંજૂરી અને સીઆઈઆરપી બંધ કરવાનો સરેરાશ સમય નોંધપાત્ર રીતે વધ્યો છે.

પુનર્ગઠન યોજનાની મંજૂરી માટેનો સરેરાશ સમય નાણાં વર્ષ ૨૦૨૩માં ૬૧૧ દિવસ હતો તેથી વધીને નાણાં વર્ષ ૨૦૨૪માં લગભગ ૮૫૦ દિવસ થઈ ગયો છે. તાજેતરના ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી નાદારી બોર્ડ ઓફ ઇન્ડિયા (આઈબીબીઆઈ)ના ડેટા અનુસાર સીઆઈઆરપી બંધ કરવાનો સરેરાશ સમય ૬૧૪ દિવસથી વધીને ૭૧૭ દિવસ થઈ ગયો છે.

ઉપરોક્ત ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે સીઆઈઆરપીનો ગાળો ફરજિયાત રીતે પૂર્ણ કરવાના મહત્તમ ૩૩૦ દિવસના સમય કરતાં વધી ગયો છે, જેમાં કોઈપણ વિસ્તરણ અથવા મુકદ્દમાનો સમયગાળો શામેલ છે.

લેણદારો દ્વારા તેમના દાવાઓના ટકાવારી તરીકે વસૂલાત ૩૧-૩૨ ટકાના સ્તરે ઓછી રહી છે. જે નાણાં વર્ષ ૨૦૨૪માં ૩૨.૮ ટકા, નાણાં વર્ષ ૨૦૨૪માં ૩૨.૧ ટકા અને નાણાં વર્ષ ૨૦૨૩માં ૩૧.૮ ટકા હતી. વધુમાં, નાણાં વર્ષ ૨૦૨૨થી શરૂ થતા દરેક નાણાકીય વર્ષમાં આઈબીબીઆઈ સાથે નોંધણી કરાવતા ઈન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ (આઈપી)ની સંખ્યા સતત ઘટી રહી છે, જે સીઆઈઆરપી પ્રક્રિયામાં મંદીનો સંકેત આપે છે. ઉ.દા. તરીકે નાણાં વર્ષ ૨૦૨૨માં આ સંખ્યા ૫૪૯ હતી, જે નાણાં વર્ષ ૨૦૨૪માં ઘટીને ૧૧૦ થઈ છે.

સીઆઈઆરપીએ આઈબીસીની જોગવાઈઓ અનુસાર કોર્પોરેટ દેવાદારની કોર્પોરેટ નાદારી ઉકેલવા માટેની પ્રક્રિયા છે. એસોસિયેશન ઓફ એઆરસી ઇન ઇન્ડિયાના સીઈઓ હરિહરા મિશ્રાએ જણાવ્યું હતું કે, આઈબીસીની મુખ્ય બાબત પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવાની છે, જેની કલ્પના કરવામાં આવી હતી. કારણ કે

તેમાં નાણાંના મૂલ્યાંકન માટે સમય મુખ્ય હોય છે. પ્રક્રિયામાં વિલંબથી મૂલ્યનું ધોવાણ થાય છે અને પ્રક્રિયાની સરળતા પર પ્રતિકૂળ અસર પડે છે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નિર્ધારિત સમયમર્યાદા પછી મંજૂર કરાયેલ પુનર્ગઠન યોજનાના ચુકાદાને બાજુએ રાખ્યો તેને કારણે પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવાની ચર્ચા ધ્યાન ઉપર આવી છે અને આપણે સમયસર પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે શ્રેણીબદ્ધ પગલાંની અપેક્ષા રાખી શકીએ છીએ.

એયુ કોર્પોરેટ એડવાઈઝરી અને લીગલ સર્વિસીસના **અક્ષત ખેતાને** નોંધ્યું છે કે આઈબીસી હેઠળ કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયાઓમાં ઘટાડો જાગૃતિમાં વૃદ્ધિ અને કોર્ટની બહાર સમાધાન માટે વધતી પસંદગીને આભારી હોઈ શકે છે. લેણદારો અને દેવાદારો હવે આઈબીસીનો ઉપયોગ ડિકોલ્ટ મિકેનિઝમને બદલે વિશ્વસનીય અવરોધક તરીકે કરી રહ્યા છે, ઔપચારિક પ્રવેશ પહેલાં વહેલાં સમાધાન અથવા પુનર્ગઠન માટે દબાણ કરી રહ્યા છે. વધુમાં, નાણાકીય સંસ્થાઓ વધુ યોગ્ય ખંતનો ઉપયોગ કરી રહી છે, જેના કારણે વ્યર્થ અથવા નબળા ફાઈલિંગમાં ઘટાડો થયો છે.